

બ્રેમ્પટન કાઉન્સિલે શહેરના નવા ઔપચારિક પ્લાન માટે રોમાંચક કાર્ય યોજના અને જાહેર મંતવ્ય એકત્રીકરણ વ્યૂહરચનાને મંજૂરી આપી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 23, 2020) – જાન્યુઆરી 22, 2020 નાં રોજ બ્રેમ્પટન સીટી કાઉન્સિલની ખાસ બેઠકમાં, કાઉન્સિલે બ્રેમ્પટન 2040 પ્લાન - શહેરના નવી ઔપચારિક યોજના બનાવવામાં સહાયરૂપ થવા નવી કાર્ય યોજના અને વ્યાપક સામુદાયિક મંતવ્ય એકત્રીકરણ વ્યૂહરચનાને મંજૂરી આપી.

વર્ષ 2017 ની પાનખર ઋતુમાં વ્યાપક જાહેર મંતવ્ય મેળવ્યા પછી, બ્રેમ્પટન 2040 વિઝનને મે 2018 માં કાઉન્સિલનું સમર્થન મળ્યું હતું. આ દૂરદેશીપાણું શહેર માટે વધારે ટકાઉ, શહેરી અને જીવંત ભાવિ વર્ણવે છે. [કાઉન્સિલની અગ્રતાઓની પરિભાષા](#) બ્રેમ્પટનને આ ભવિષ્ય તરફ દોરવા મુખ્ય પગલાઓની રૂપરેખા સૂચવે છે. બ્રેમ્પટન 2040 પ્લાન આ પ્રક્રિયાનો એક નિર્ણાયક ભાગ છે, અને આ નવી ઔપચારિક યોજના તમામ શહેરી આયોજનો, પ્રોજેક્ટ્સ અને વિકાસ યોજનાઓ બ્રેમ્પટન 2040 વિઝનની મહત્વાકાંક્ષાઓને હાસલ કરવા એકસાથે કાર્યરત હોવાની ખાતરી કરવાની દિશા પૂરી પાડશે.

બ્રેમ્પટન 2040 પ્લાનની રચના કરવામાં સીટી સ્ટાફને સહાયરૂપ થવા, સીટી દ્વારા [WSP કેનેડા ગ્રુપ લિમિટેડ](#)ને રોકવામાં આવી છે જેઓ જમીન વપરાશ આયોજન, કાર્યનીતિ આયોજન અને શહેરી ડિઝાઇન; સમુદાયો અને હિતધારકોને પ્રવૃત્તમય કરવા; ટકાઉપણું; પરિવહન; પર્યાવરણલક્ષી આયોજન; ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાનું આયોજન; અને કળા, સાંસ્કૃતિક આયોજન અને વારસો જતનના ક્ષેત્રોમાં બહુવિધ પ્રયત્નોમાં નિપુણતા પૂરી પાડશે.

આજે મંજૂર કરેલી કાર્ય યોજના પાંચ તબક્કાઓની બનેલી છે જે બે વર્ષ ઉપરાંતના સમયગાળામાં 2022 સુધી વિસ્તરણ પામશે, જેમાં રહેવાસીઓને શહેર માટે પ્રવૃત્તમય થવાની અને બ્રેમ્પટનના વિકાસના ભવિષ્યનો આકાર ઘડવાની બહુવિધ તકો રહેશે.

મહત્વના કમ્યુનિટી એન્ગેજમેન્ટ માઈલસ્ટોન્સ (સામુદાયિક મંતવ્ય એકત્રીકરણ સીમાચિહ્નો)

તબક્કો 1: **બ્રેમ્પટન 2040 સ્પીકર સીરીઝ** – આ ઉચ્ચ સ્તરીય મહત્વાકાંક્ષી દૂરદેશીપાણુંને સફળ અમલીકરણ યોજનામાં તબદીલ કરવા તરફ ખાસ ધ્યાન આપીને સમુદાયમાં શહેરી આયોજનની વધારે જાગરૂકતા લાવવાનો હેતુ ધરાવે છે.

તબક્કો 2: **2040 વિઝનનું પરીક્ષણ કરવું અને ડેટા ગેપ્સ (અંતરાયો) ઓળખવા** – એક મંતવ્ય એકત્રીકરણ કાર્યક્રમ બ્રેમ્પટન 2040 વિઝનનું પરીક્ષણ કરવા અને ઉપસ્થિત હોઈ શકતી કોઈ ડેટા ગેપ્સને ઓળખી કાઢવા ઈનપુટ્સ (મંતવ્યો અને સૂચનો) મેળવશે.

તબક્કો 3: **કમ્યુનિટી સ્ટ્રક્ચર વર્કશોપ્સ** – આ તબક્કા દરમિયાનની પ્રવૃત્તિ બ્રેમ્પટન 2040 વિઝનની રૂપરેખા જ્યારે શહેર સામુદાયિક માળખું બનાવે, પરીક્ષણ કરે અને મંજૂર કરે ત્યારે ઈનપુટ્સ (મંતવ્યો અને સૂચનો) મેળવશે.

તબક્કો 4: **ચર્ચા કાગળો અને કાર્યનીતિ નિર્દેશોનો કાર્યો મુસદ્દો** – આ પ્રવૃત્તિ કાર્યક્રમ ચર્ચા કાગળો અને કાર્યનીતિ નિર્દેશોના અહેવાલ મારફતે સ્પષ્ટીકરણ કરેલા બ્રેમ્પટન 2040 પ્લાનની દિશા જણાવવા પાયાના વિષય ક્ષેત્રો (બ્રેમ્પટન 2040 વિઝનના સાત પાયાના દૂરદેશીપાણું કથન ક્ષેત્રો) પર ઈનપુટ્સ (મંતવ્યો અને સૂચનો) મેળવશે.

તબક્કો 5: અંતિમ OP કાર્યનીતિઓ – આ તબક્કા દરમિયાન, શહેર બ્રેમ્પટન 2040 પ્લાનના ડ્રાફ્ટમાં (કાચા મુસદ્દામાં) સમાવેલી ડ્રાફ્ટ કાર્યનીતિઓ પર ઈનપુટ્સ (મંતવ્યો અને સૂચનો) મેળવશે.

વ્યૂહરચનામાં રેખાંકિત કરેલી કાર્ય યોજના અને સામુદાયિક પ્રવૃત્તિ તકોની રચના સફળ બ્રેમ્પટન 2040 વિઝન પ્રક્રિયા મારફતે સ્થાપિત દૂરદેશીપણાને પ્રતિબિંબિત કરતી આશાવાદી ઔપચારિક યોજના બનાવવા માટે કરવામાં આવી છે.

બ્રેમ્પટન 2040 પ્લાન માટે કાર્ય યોજના અને મંતવ્ય એકત્રીકરણ વ્યૂહરચના વિશે વધુ જાણવા, કૃપા કરી [અહેવાલ](#) જુઓ અને [વેબસાઇટ](#) જોઈને અદ્યતન માહિતી મેળવો અને તકો વિશે જાણો જ્યારે વ્યૂહરચના ઘડવામાં આવે.

બેકગ્રાઉન્ડ (પશ્ચાદભૂ)

સીટીની હાલની ઔપચારિક યોજના કાઉન્સિલ દ્વારા ઓક્ટોબર 2006 માં સ્વીકારવામાં આવી હતી અને ઓન્ટેરિયો મ્યુનિસિપલ બોર્ડ (OMB) દ્વારા ઓક્ટોબર 2008 માં મંજૂર કરવામાં આવી હતી.

પ્લાનિંગ એક્ટની સેક્શન (આયોજન અધિનિયમની કલમ) 26(1) માં અનિવાર્ય છે કે મંજૂર કરેલી દરેક ઔપચારિક યોજનાને નવી ઔપચારિક યોજના તરીકે અમલમાં આવ્યા પછી 10 કરતા ઓછાં વર્ષોમાં ન આવેલી પ્રોવિન્સની યોજનાઓ અને કાર્યનીતિઓ સાથે સુમેળ અને સુસંગત હોવાની ખાતરી કરવા સુધારણા માટે વિચારવામાં આવે; અને ત્યાર પછી દર પાંચ વર્ષે, સિવાય કે તે યોજનાને બીજી એક નવી ઔપચારિક યોજનાથી બદલવામાં આવે.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટનને હમણાં અને ભવિષ્યમાં, બંને માટે શહેરના વિકાસ માટેનો તબક્કો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી શહેરની નવી ઔપચારિક યોજના બનાવવા માટે સમુદાયને આવરી લઈને મંતવ્ય એકત્રીકરણ પ્રક્રિયા રજૂ કરવા ઉત્સાહિત છે. અમારી બહુવર્ષીય યોજના ખાતરી કરાવશે કે રોમાંચક સામુદાયિક દૂરદેશીપણું બ્રેમ્પટનમાં દરેક વ્યક્તિને લાભાન્વિત કરવામાં પરિણમે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“એક કાઉન્સિલ તરીકે અમારી અગ્રતા શહેર માટે વધારે ટકાઉ, શહેરી અને જીવંત દિશા નિર્ધારિત કરવાની છે – અને અમારી નવી ઔપચારિક યોજના બિલકુલ તે જ કરશે. હું તમામ બ્રેમ્પટનવાસીઓને આપણાં શહેરને ભવિષ્યને ધ્યાનમાં લઈને વિકસાવવામાં તમારા અવાજને સાંભળવા અને વિકાસની રીતોને ઘડવા ઉપલબ્ધ ઘણી તકોમાંની એક તકમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું.”

- માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ

“આ ઔપચારિક યોજના શહેર નિર્માણનું કામ કરવા સીટી સ્ટાફ માટે વધારે સંદર્ભ એવી રીતે પૂરો પાડશે જે બ્રેમ્પટન માટે આપણી કાઉન્સિલના અને રહેવાસીઓના દૂરદેશીપણાને સ્પષ્ટપણે જાણવાની તકો મહત્તમ બનાવે. આ શહેર આપણને બ્રેમ્પટન 2040 વિઝન હાંસલ કરવા તરફ વધારે નજીક લાવવા રહેવાસીઓ અને હિતધારકો સાથે કામ કરવા આશાવાદી છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca